

## માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અશાબ્દિક તર્કશક્તિ કસોટીની રચના અને પ્રમાણીકરણ

- ડૉ. શાહિના યુ. બરફવાલા

તર્કશક્તિ એ માનવમાં રહેતી વિશિષ્ટ પ્રકારની શક્તિ છે. સમસ્યા ઉકેલની પ્રક્રિયામાં તર્કશક્તિ મહત્વનો ભાગ ભજવે છે. બાળકમાં તર્કશક્તિ અમુક ઊંઘર પણ જ જોવા મળે છે. રોજબરોજના કાર્યોમાં, શૈક્ષણિક સિદ્ધિમાં તથા કેટલાક વ્યવસાયોમાં સફળ થવા માટે બુદ્ધિને બહલે તર્કશક્તિની ભૂમિકા મહત્વની હોય છે. પ્રસ્તુત અભ્યાસમાં સ્વતંત્ર રીતે અશાબ્દિક તર્કશક્તિ કસોટી રચી, સમગ્ર ગુજરાત રાજ્યના નમૂના પર તેનું પ્રમાણીકરણ કરવામાં આવ્યું છે.

### ● અભ્યાસનું મહત્વ

ડૉ. કુ. ઈ. ઈ. દ્વારા યોજવામાં આવતી રાષ્ટ્રીય પ્રતિભા શોધકસોટીમાં, બેન્કોમાં કારકૂન અને અધિકારીઓની ભરતી માટે યોજાતી સ્પદિતમક કસોટીમાં પણ અશાબ્દિક તર્કશક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં તર્કશક્તિ પાયાની બાબત છે. ગુજરાત રાજ્યની સમગ્ર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની અશાબ્દિક તર્કશક્તિનું માપન કરી તેમને માર્ગદર્શન આપવાના કાર્યમાં સહાયભૂત થવા તથા રેલ્વે, બેંકની જાહેર પરીક્ષાઓમાં અશાબ્દિક તર્કને લગતા પ્રશ્નોમાં માર્ગદર્શન માટેના ઉત્તેસર અશાબ્દિક તર્કશક્તિ-કસોટીની રચના અને પ્રમાણીકરણ કરવાનું નક્કી કર્યું છે.

### ● અભ્યાસના હેતુઓ

- ધોરણ માટે અશાબ્દિક તર્કશક્તિ-કસોટીની પ્રમાણિત કરવી અને તેને રચના કરવી અને તેને પ્રમાણિત કરવી.
- ધોરણ માટે અશાબ્દિક તર્કશક્તિ કસોટીના પ્રાપ્તાંકો ઉપર જાતિ, ધોરણ અને વિસ્તારની અસર તપાસવી.

### ● વ્યાપવિશ્શે

પ્રસ્તુત અભ્યાસ સમગ્ર ગુજરાતના ગુજરાતી માધ્યમના તમામ માધ્યમિકશાળાના ધોરણ : માટે અને ધોરણ વિદ્યાર્થીઓ પૂરતો મયાહિત હતો.

### ● સંશોધન ઉપકરણ

પ્રસ્તુત અભ્યાસમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અશાબ્દિક તર્કશક્તિ કસોટીની રચના કરી તેને પ્રમાણિત કરવાની હતી. તર્કશક્તિને લગતા સંફર્મુલનોના અભ્યાસ તથા ધોરણ માટે ધોરણ માટે અને ધોરણ વિદ્યાર્થીઓની વય અને કષાને ધ્યાનમાં રાખી પ્રસ્તુત કસોટીમાં (૧) શ્રેષ્ઠી (૨) સમસંબંધ (૩) વગ્ગકરણ (૪) આફ્રિતિઓની પૂર્વિત (૫) આફ્રિતિઓની ગોઠવણી - એમ કુલ પાંચ વિભાગો રાખવાનું નક્કી કર્યું. પ્રત્યેક વિભાગ માટે ૨૦-૨૦ કલમોની રચના કરી, ચકાસણી માટે તજ્જોને કસોટીનું પ્રારંભિક સ્વરૂપ મોકલવામાં આવ્યું. સૂચના મુજબના પ્રારંભિક સ્વરૂપમાં ફેરફાર કરી ૨૦-૨૦ કલમોવાળી કસોટીનું પૂર્વપ્રાથમિક અજમાયશ માટેનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું. પૂર્વપ્રાથમિક અજમાયશ ધોરણ માટે ધોરણ વિદ્યાર્થીઓ પર કરવામાં આવી. પૂર્વપ્રાથમિક અજમાયશ કસોટીની કલમોના વિકર્ષણોના પૃથક્કરણ બાદ પ્રત્યેક વિભાગમાં ૨૦-૨૦ કલમો સમાવી, પ્રાથમિક અજમાયશ કસોટી તૈયાર કરી. અમદાવાદના શહેરી વિસ્તારની રાજ્ય અને ગ્રામ્ય વિસ્તારની રાજ્ય એમ કુલ ૪ માધ્યમિક શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ પર પ્રાથમિક કસોટીની અજમાયશ કરવામાં આવી. અધૂરી વિગતોવાળા ઉત્તરપત્રો રેફર કરતા ૩૭૦ ઉત્તરપત્રોને કલમપૃથ્યકરણ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા. અંતિમ કસોટી માટે હેઠળ વિભાગમાંથી ૧૦-૧૦ કલમોની પસંદગી સરળતામૂલ્ય અને ભેદપરખ મૂલ્યને ધ્યાનમાં રાખી કરવામાં આવી. પ્રાથમિક અજમાયશ હરચ્યાન